

R.N.I.No. : 11555/1966

Price Rs. 1/-



જ્યોતિ પુંજ

JYOTI PUNJ

Vol No. 56 Issue No. 7

October - 2013

નવા વર્ષનો સંકલ્પ


જેમ દરીયો પોતાના નકામા શંખો તથા છીપલાને કિનારે ફેંકી મહામુલા મોતી જેવાં રત્નોને સમાવી લે છે તેમ, આપ સૌ આપના અહંકાર, ક્રોધ, માન, માયા તથા મારા-તમારાની ભાવનાને નવા વર્ષના ઉમળકા ભર્યા મોજામાં કિનારે ફગાવીએ. જેમ સમુદ્ર જળચરોના વિષને સમાવી લે છે તેમ, જીવનમાં જે ખરાબ બની ગયું તે ભુલીને સુસંસ્કાર, સુવિચારો સમાવીએ. આંખને રૂપાળું ગમે, કદરૂપું ન ગમે, કાનને સંગીત ગમે, ઘોંઘાટ ન ગમે, જીભને મધુર ભાવે, કડવું ન ભાવે, મનને સુખ ગમે, દુઃખ ન ગમે.

આ જગતમાં કેટલાક જીવો આ પાણી જેવા હોય છે.. ગમે તેવા વિષમ સંજોગો વચ્ચે કે ગમે તેવા વિચિત્ર સ્વભાવવાળી વ્યક્તિ સાથે રહેવાનો પ્રસંગ તેઓને નડ્યો હોય તેઓ ક્યારેય અકળાતા નથી... ગભરાતા નથી કે આવેશમાં આવતા નથી! પોતાના મનની પ્રસન્નતાને અખંડિત રાખવામાં તેઓ નિષ્ફળ જતા નથી!

નવા વર્ષમાં આપણે આપણા જીવનને આ 'પાણી' જેવું બનાવી દેઈએ.. સંસાર છે એટલે ન ધારેલું ઘણું બધું બની જવાનો સંભવ છે. માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે નવા વર્ષનું સુવર્ણ પ્રભાત સૃષ્ટિ પર પ્રસન્નતા પાથરે છે, અને આપણે પણ જીવનમાં સદાચાર, સુવિચાર અને સેવાપરાયણતાના મંગલ દિપ પ્રગટાવીએ એવી શુભભાવના સાથે આપણા સર્વ પરિવારના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સુખાકારી અને મંગલતા વર્તે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ.



સાથે મળીને ગતી કરીએ, સાથે વાણી વદીએ,
સાથે મળીને મનથી સઘળું સાચું સમજી લઈએ,
સાથે મળીને કરી પ્રાર્થના, હળીમળીને રહીએ,
ચિત્ત અને મન આપણા સહુના સરખે સરખા કરીએ,
લાગણી આપણી સમાન હો ને હૃદયે સમાન કરીએ,
સમાન મનમાં બધાં એકતા સંપ કરીને રહીએ.




SHREE BALASINOR NAVYUVAK SANGH

Circular No. 3/2013 7th August 2013

APPEAL

SIX DONORS OF ₹ 25 LAKHS FOR SIX UNITS



2 YEAR PROJECT

PRESIDENT
Kalpesh S. Dharia
(Balbal)
M : 9820183907

HON. SECRETARY
Bhavesh B. Mody
M : 8879422304

It gives us immense pleasure to acknowledge the donor for Rs 1 crore who responded spontaneously to our appeal made in July, 2013 edition of Jyoti Punj for acquiring a community hall for Balasinorians in the city of Mumbai..

The path has been made easy but the goal is yet to be reached. In order to achieve the goal of acquiring a community hall and as per our last circular regarding various other schemes for the balance fund of Rs. 2.75 crore.

We propose the following:

A scheme of inviting donations in multiples of Rs 25 lakhs i.e six units of Rs. 25 lakh each. Each donor will be honored with a name embossed along with the photo as per donor's wish, which is to be framed in the community hall for the patrons to offer their heartfelt gratitude.

'We only have what we give.'

It is just a beginning and we expect all of us to join this important cause by contributing generously.

For any information contact following persons:

<p>RAJNIKANT K. KADAKIA (DHARIWALA) M:+91 9820616469</p> <p>Pravinchandra K.Shah (P.K.) M:+91 9821575238</p> <p>DAXESH B. KADAKIA (LATKARI) HON. MEMBER M: +91 9833176158</p>	<p>KALPESH S. DHARIA (BALBAL)-PRESIDENT M:+91 9820183907</p> <p>SAUMIL J. MODY VICE-PRIDENT M:+91 9920213426</p> <p>BHAVESH B. MODY HON. SECRETARY M: +91 8879422304</p>	<p>JASMIN B. SHETH JT. SECRETARY M:+91 9820830060</p> <p>NILESH N. SHAH JT. SECRETARY M:+91 8082432301</p> <p>NIKESH J. GANDHI TREASURER M: +91 9820496534</p>	<p>YOGESH R. DHARIA HON. MEMBER M:+91 9821544950</p> <p>RAJENDRA K. DESAI HON. MEMBER M:+91 9820080194</p> <p>VRAJESH N. DESAI HON. MEMBER M: +91 9820039304</p>
--	---	---	---

જ્યોતિ પુંજ



વર્ષ અંક તારીખ
૫૭ ૦૭ ૨૧-૧૦-૨૦૧૩

છુટક કીમત : રૂ. ૧/- વાર્ષિક લવાજમ : રૂ. ૧૦/-

નિખિલ પરીખ (તંત્રી)

જતીન ન. દેસાઈ / દેવાંગ મોદી

જીગર કડકીઆ / બંકિમ પરીખ

પત્રવ્યવહારનું સરનામું

નિખિલ પરીખ (ફોન : ૨૩૮૨ ૨૫ ૧૦)

વીલગ્રીન કોમર્શીયલ કોરપોરેશન

૬, ખોખા બજાર, મુંબઈ-૪૦૦ ૦૦૩.

ફોન : ૯૮૨૧૩૨૬૪૩૨



મંત્રી : ભાવેશ બીપીન મોદી (ઠાસરાવાલા)

એ. કે. એન્ટરપ્રાઈઝ

૫૪-બી, ગૌરક્ષક ચાલ, ૧ લે માળે, રૂમ નંબર - ૧૩,

ફણસવાડી, મુંબઈ-૪૦૦ ૦૦૨

ટે.(ઓ.) : ૨૨૦૬૦૦૦૯ (મો.) : ૯૮૬૯૦૮૦૨૮૭



: કાર્યાલય :

૧૧૮/૧૨૦, અરદેશર દાદી સ્ટ્રીટ, વી.પી. રોડ,

મુંબઈ - ૪૦૦ ૦૦૪. ટે.નં. : ૨૩૮૮ ૭૦૦૬



: સમય :

સોમવાર થી શનિવાર ૨ થી ૭ (સાંજે)

રવિવાર ૯.૩૦ થી ૧૧.૩૦ (સવારે)

દર બુધવારે સંસ્થાની ઓફિસ બંધ રહેશે.

visit us at www.balasinor.org

તંત્રી મંડળ તરફથી

આ દિવાળી થી કંઈક નવું કરીએ..

- બંકિમ રજનીકાન્ત પરીખ (જુનાગઢવાળા)

અસતો મા સદ્ગમય ।

તમસો મા જ્યોતિર્ગમય ।

મૃત્યોર્મા અમૃતંગમય । ।

અસત્ય થી સત્ય તરફ, અંધકાર અને અજ્ઞાનથી પ્રકાશ અને જ્ઞાન તરફ, અસુરો પર સુરોનો વિજય ઉત્સવ એટલે દિવાળી.

સાલમુબારક, નૂતનવર્ષાભિનંદન. આપસવેનું નવું વર્ષ મંગલદિપના ઉજ્જવળ પ્રકાશથી જ્ઞાનદાયક, સમૃદ્ધિ સભર બની રહે અને ઠાકોરજીની અસીમકૃપાથી આપના જીવનમાં સત્, ચિત્, આનંદનો ત્રિવેણીસંગમ થાય તેવી પ્રાર્થના. આત્મીય બાલાસિનોરવાસીઓ નવા વર્ષના જીવનચોપડામાં લાભશુભના અર્પનારા શ્રી ગણેશનું એવું સ્થાપન થાય કે વર્ષાતે સરવૈયામાં સ્વાસ્થ્ય, સત્કર્મો, સદ્ગુણો, શેષ રહે, પ્રાપ્ત થાય.

આ દિવાળી થી કંઈક નવું વિચારીએ કંઈક નવું કરીએ.

૧) પહેલું સુખ તે જાતે નર્ચા.

સૌ પ્રથમ પોતાની તબિયત તરફ નજર કરીએ.

શારિરીક રીતે સુસજ્જ રહેવા માટે વોર્કિંગ,

જોર્ગીંગ, સાઈકલીંગ, સ્વીમીંગ, જીમ, યોગ,

સ્કૂલમાં શિખેલી કસરતો વગેરે કંઈપણ શરૂ

કરીએ. યોગ દ્વારા શારિરીક ઉપરાંત માનસિક

શક્તિઓ પણ પ્રાપ્ત થશે.

૨) જરૂરિયાતમંદ કુટુંબની વ્યક્તિને તબિયતના

અનુસંધાનમાં યોગ માટે પૂછપરછ કરવી હોયઢ

- અથવા એ માટે શિખવું હોય તો આ લખનાર નિ:શુલ્ક માહિતી આપશે.
- ૩) ઘર-ઓફિસ માંથી નકામો, વધારાનો સમાન કાઢી નાખી ઉર્જા વહેતી રાખવી. નવી ટેકનોલોજીના ઉપકરણો વસાવવાની કોશિષ કરવી અને દેશ-દુનિયા સાથે તાલમેલ રાખવો.
- ૪) દિવાળી-દેવદિવાળી દરમ્યાન થોડા કુટુંબો ભેગા મળી અન્નકુટ કરવો, ઉજાણી કરવી. ઠાકોરજીનો અન્નકુટ આરોગવો એ પણ એક લ્હાવો છે. આમા પાંચ-દસ નવા નવા કુટુંબોએ સાથે મળી કુટુંબીજનોને દર્શન કરાવવા, સેવાનો લાભ આપવો. પાર્ટી કરનારાએ નવા નવા બાલાસિનોરના કુટુંબીજનો સાથે પોતાની રસસભર વાનગીઓની ઉજાણી કરવી. આનાથી ભાઈચારો ફેલાશે, એકબીજાના બાળકો પરિચિત બનશે. કુટુંબીજનો જો ભેગા થશે તો સંયુક્ત કુટુંબની ભાવના ફેલાશે તથા નવા સુંદર પરિણામો પ્રાપ્ત થશે.
- ૫) તમારી આવડતનું કંઈક સુંદર કાર્ય, નવી વસ્તુ બનાવતાં બાળકને શિખવવું. બાળકના હાથે રંગોળી, સાથિયા તો કરાવવા, તોરણોના ડેકોરેશન કરાવવા. ઘરમાં રાયરથીલું અલગ પ્રકારે ગોઠવવું અને નવો માહોલ ઊભો કરવો.
- ૬) રોજિંદા જીવનમાં, હવહારમાં જે વ્યક્તિઓ આપણને મદદરૂપ નિવડે છે, જે આપણા પર આશા રાખીને બેઠા છે તેવી વ્યક્તિની દિવાળી સુધરે, સારી જાય તેવા યોગ્ય નિર્ણયો લેવા, મદદ કરવી.
- ૭) દિવાળી સારી રીતે પસાર થઈ જાય તે માટે દિવાળીના પાંચ-સાત દિવસ પહેલા ઉપવાસ, એકટાણા (તમારા સ્વાસ્થ્ય મુજબ જ) ચાલુ કરવા અને તહેવાર પતી ગયા પછી પાછા પાંચ સાત દિવસ ઉપવાસ, એકટાણા ચાલુ કરવા. આનાથી ઘણા બધા પ્રકારના ફાયદા થશે અને આરોગ્યની પ્રાપ્તિ થશે.
- ૮) પામતા પહોંચતા ન હોય તેવા કુટુંબીજનો, મિત્રોને ઉજવણીમાં સામેલ કરવા, સર્વત્ર ખુશીનું વાતાવરણ ફેલાવવું.
- ૯) નવા વર્ષના શુકન સમાજની સંસ્થાઓમાં દાન આપી કરવા.
- ૧૦) તમારા કુટુંબના બાળકો સારી પોસ્ટ પર જોબ કરતા હોય તો સમાજના કુટુંબીજનોના મિત્રોના હિતાર્થે નાના પાયે અન્ય માટે આપણી સંસ્થામાંથી લોન માટે ગેરેન્ટી અપાવવાનું પ્રોત્સાહન આપવું આથી સમાજની સંસ્થાઓમાં યુવાશક્તિઓનો ફાળો વધશે. બીજા કલ્યાણકારી કાર્યો કરવા પ્રોત્સાહિત કરવા.
- ૧૧) બધાજ પ્રકારના વ્યસનો થી દૂર રહેવા સંકલ્પ કરવો, કોશિષ કરવી. બીડી, સિગારેટ, પાન, તમાકુ, ચરસ, ગાંજો, અફીણ, હુક્કા વગેરે. આ વ્યસનો તબિયત અને પૈસા ખાઈ જાય છે. મનની અને ઘરની પરિસ્થિતિને ડામાડોળ કરી મૂકે છે.
- ૧૨) શ્રી ગીતાજીમાં શ્રીકૃષ્ણ કહે છે 'વૃક્ષોમાં પીપળો હું છું. અર્થાત્ દરેક વનસ્પતિ દેવીશક્તિઓથી સભર છે. તમારી આસપાસના વાતાવરણમાંથી કોઈ એક મોટા વૃક્ષને તમારું મિત્ર બનાવો. બધા જ દુ:ખ, દર્દ, પીડા એને કહી દો અને મનનો ઉભરો બહાર ઠાલવી દો આથી રાહત થશે. ચિંતા, બ્લડપ્રેશર, હાર્ટ એટેક, પેરેલીસીસના એટેક જેવી પરિસ્થિતિઓમાં રાહત થશે, દૂર થશે.

તમારા હાથે તમારી સમજથી તમારું આરોગ્ય સુધરશે. આપણા મેડિકલ સેન્ટરો આપણી સેવા માટે જ છે. તેનો પણ જરૂર લાભ લઈએ.

૧૩) શિક્ષણનો સેવાયજ્ઞ ફેલાવીએ.

સ્કૂલ-કોલેજોમાં ભણતા બાળકોને મદદરૂપ થવા આગળ આવવું. આપણી સંસ્થામાં ભણાઈ ગયેલા પુસ્તકો દાન આપવા. આર્થિક રીતે દાન આપી શિક્ષણના કાર્યમાં મદદરૂપ થવું. ઘણા બધા કારણોને લીધે બાળકને ફરજિયાત ટ્યુશન કલાસ ભરવા પડે છે. મોટા ધોરણોની ફી ઉપરાંત ટ્યુશન ફી લાખોમાં પહોંચી ગઈ છે. આપણી આસપાસ રહેતા બાલાસિનોર વાસીઓના બાળકોને ઓછા દરે અથવા મફત શિક્ષણ પૂરું પાડવું. આ માટે એરિયા પ્રમાણેના કાર્યકર્તાઓ દ્વારા પહેલ થાય તો મોંઘવારી રૂપી મગરના જડબામાંથી આપણી જ નાતના બાળકોનો છુટકારો થાય, સમાજ એક બીજાની નજીક આવતો થાય. બાળકોનું નવું મિત્રવર્તુળ નિર્માણ થશે.

૧૪) પતિ-પત્નીએ એકબીજાના ભરણપોષણના અને રહેઠાણના માર્ગ જીવનભર સુરક્ષિત રહે તે માટે વારસા-વિલ બનાવી રજીસ્ટ્રેશન કરાવી લેવું.

૧૫) ઘર-દિવડા પ્રગટાવવા સમાજે આગળ આવવું પડશે. રોજ રોજ વધતી મોંઘવારીના આ વિષયકમાં સમાજને એકજૂટ રાખવા સમાજના મુરબ્બીઓએ, અધિકારીઓએ નવા નવા નિર્ણયો લઈ સમાજ માટે નવા નવા દ્વાર ખોલવા પડશે, પથદર્શક બનવું પડશે. કોઈ એક દિવાનો પ્રકાશ મારા માટે છે તેવી સમાજના લોકોને ખાતરી થશે.

જીવડો

તારા પાપણના અશ્રુ સુકાય
જીવડો મનમાં ને મનમાં મુંઝાય
તારી જીભલડી ઝોલા ખાય
જીવડો મનમાં ને મનમાં મુંઝાય
તારા કર કમળના લંબાય
જીવડો મનમાં
તારા પાયલમાં ઝણ ઝણ થાય
જીવડો મનમાં
તારા કાચા તો કાન કહેવાય
જીવડો મનમાં મનમાં
તારા નયનોમાં ઝાંખી થાય
જીવડો મનમાં મનમાં
તારી નાવડી ઝોલા ખાય
જીવડો મનમાં
જ્યારે બોલાવે રાધાના શ્યામ, ત્યારે જીવડો રાજી રાજી થાય..
- સરલાબેન દેસાઈ (દેડકી)

**‘વ્હાલ મુબારક, વ્હાલ મુબારક, વ્હાલ મુબારક
આપ સૌને નવું સાલ મુબારક’
(હેપ્પી દિવાળી)**

- દેવાંગ રાજેન્દ્ર મોદી (પેપરવાળા)

મારાં સપના તારી આંખે સાચા પડતા જાય

એને નવું વર્ષ કહેવાય.

હું કાંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય

એને નવું વર્ષ કહેવાય.

ખુલ્લી સવાર જેવું જીવન કાચમ

મસ્ત મજાનું પકડાઈ જવાની મજા પડે ને

એવું કાઠશું બહાનું

લાભ, શુભ ને ચોઘડિયા પણ અંદરથી શરમાય

એને નવું વર્ષ કહેવાય.

જીવન એવું જીવન જાણે સહજ અવતરે

પ્રાસ નીતરતા શ્વાસમાં ઘુટશું

ઈશ્વરનો અહેસાસ.

ટૂંકમાં તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાય

એને નવું વર્ષ કહેવાય...

આપણા જીવનમાં તહેવારો સુખદ બ્રેક્સ લઈને આવે છે. રૂટિન કરતા જુદી રીતે જીવવાની ગિફ્ટ લઈને આવે છે. પોતાના સ્વજનો દોસ્તો સાથે બોન્ડિંગ કરવાની તક લઈને આવે છે.

જ્યોતિપુંજનો આ અંક તમારા સુધી પહોંચશે ત્યારે તમે દિવાળીની તૈયારી કરતા હશો. દિવાળી માટેના કંઈક કેટલા પ્લાન કર્યા હશે. બાળપણથી લઈને આજ સુધીની દિવાળી યાદ કરશો તો તમારી નજર સામે કેટ કેટલી યાદોના રંગીન તોરણો બંધાઈ જશે. નવા

ટ્રેસિસ, નવા શુઝ, મનભાવતી મીઠાઈઓ અને નાસ્તાઓ. રાત પડે ફટાકડા ફોડવાનો રોમાંચ નવા વર્ષ આડોશી, પાડોશી અને સગા સંબંધીઓને ત્યાં સાલ મુબારક કરવા જવાનું આશીર્વાદ સાથે રૂપિયો કે બે રૂપિયાની કડકડતી નોટ મળતી, લક્ષ્મી પૂજન વખતે કવર મળતું.

પરંતુ ત્યાર પછીના વરસોની દિવાળી યાદ કરતા એનું સ્વરૂપ બદલાયેલું દેખાશે. દિવાળીની ઉજવણી નિમિત્તે થયેલી પ્રવૃત્તિઓમાંથી ઘણી બાદ થયેલી જણાશે. અત્યારે કોઈને પૂછશો ઘરની સાફ સૂફી થઈ ગઈ. જવાબ મળે અરે આખું વરસ સાફસૂફી તો થાય છે ને. નાસ્તા અને મીઠાઈઓ બનાવ્યા. તો જવાબ મળે અરે એવા તળેલા નાસ્તા અને મીઠાઈઓ કોઈ ખાતુ નથી હવે એ બધાનું સ્થાન પાર્ટીઓ અને ગીફ્ટસે લઈ લીધું છે. હોટેલ્સ કે રેસ્ટોરામાં ડિનર કે લંચે લઈ લીધું છે. સાદા શબ્દોમાં લખુ તો દિવાળીનો તહેવાર એ આપણા શહેરીજનો માટે વેકેશનની રજાઓ બની ગયેલો દેખાશે. કામકાજ કે પ્રોફેશનને હિસાબે શહેરોમાં રહેતા કેયલાયે કપલ્સને બાળકો દિવાળીની રજાઓની રાહજોતા હોય છે. જેથી રજાઓમાં ઘરથી દૂર ક્યાંક વેકેશનમાં ઉપડી જવાય.

પહેલા તો આપણે સૌ દિવાળીમાં સગાવડાલા, મિત્રો ને ઘરે સાલમુબારક કરવા જતા. વડીલો-સ્નેહીઓના આશીર્વાદ લેતા. પરંતુ આજકાલની ફાસ્ટલાઈફમાં જ્યાં લોકો પોતાના માટે સમય નથી ફાળવી શકતા તેમને પહેલી નજરમાં લોકોની સાથે હળવું મળવું બહુ ઈમ્પોટન્ટ ન લાગે પણ હકીકતમાં ઉત્સવો દરમ્યાન થતાં આત્મીયજનોના પ્રેમ અને મિલન મેળા એતો સ્વજનોના પરસ્પર વિશ્વાસ, સ્નેહ અને

પ્રેમની મૂડીમાં વૃદ્ધિ કરનારા મજબૂત વિટામીન્સ છે. જીવનમાં જે ખૂટે છે એ જીવનરસ સીંચવવાની તાકાત. કદાચ આવા સંબંધો અને બોન્ડિંગમાં રહેલી છે. એટલે જ આ તહેવારો નિમિત્તે મળતી આ તક ને વેડફો નહીં. પર્સનલી ના પહોંચી શકાય એમ હોય ત્યાં પરોક્ષ રીતે ફોન, સંદેશ, ઈમેઈલ, વોટસ-અપ, ફેસબુક થી પણ પહોંચીને સંબંધો અને દોસ્તીના દીવામાં તેલ પૂરતા રહીએ, અને સંબંધોની બેંકમાં શક્ય એટલી આશીર્વાદ રૂપી પ્રેમની ડીપોઝીટ વધારીએ.

દિવાળી નિમિત્તે આપ સૌને શુભ દિવાવલી અને આવનારા નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. દિવાળીના દીવડાઓ તમારા અંતરને ઝગમગાવે, આંગણે પૂરેલા સાથિયાઓ મિત્રો અને સ્નેહીઓ વચ્ચે આત્મીયતા વિકસાવે.

આ પર્વદિને એવી પ્રાર્થના કરીએ કે કોઈકના જીવન દીવડામાં આપણે પ્રકાશ રેલાવી શકીએ. કોઈકના મુરઝાયેલા ચહેરા પર સ્મિત ઝળકાવી શકીએ. કોઈકના જીવન આંગણે મધુર રંગોળી કરી શકીએ, ફટાકડાના શોરમાં દીન દુખિયાનો આર્તનાદ ભૂલીના જઈએ. ઈશ્વરે આપણને જે આપ્યું હોય. તેનાથી થોડું બીજાને વહેંચીએ અને આવું એક જ દિવસ નહીં આવનારા પ્રત્યેક દિવસે કરીએ. પ્રત્યેક પળને ઉલ્લાસથી વધાવીએ નિત્ય નવા ઉત્સાહ અને ઉમંગથી જીવનનો ઉત્સવ ઉજવીએ. દિવાળીનો આ પર્વ ફટાકડા અને મીઠાઈઓ પૂરતો સિમિત ન રહેતા પ્રેમ અને આનંદનો પર્વ બને એવી આપ સૌને અંતરથી શુભકામનાઓ.

પ્રકાશ પર્વે આત્મદીપ પ્રગટે તેવી શુભેચ્છા. રંગોળી, દિવડા અને ઉરના ઉલ્લાસ સાથે આપસૌને હેષ્ટી દિવાલી દિલસે ...



ક્ષમા યાચના



છેલ્લા દસ વર્ષથી વૈદ્યરાજના નામે ઓળખાતા ગોળાઓ આસરે સાતેક હજાર જરૂરીઆતવાળાઓને વિના મુલ્યે આપવામાં આવ્યા. આ ગોળાઓ પડતર કિંમતે બનાવી આપનાર સ્વ. પૂનમચંદ વૈદ્યરાજના પુત્રી સુરેખાબેન અશ્વિનકુમાર ગાંધી હવે કાયમી વસવાટ અમેરિકા ખાતે કરતા હોવાથી, હાલના તબબકે ગોળાઓ બની શકે તેમ નથી. મારી પાસે વૈદ્યરાજના ગોળા લેવા આવનાર વ્યક્તિઓને નિરાશ કરવા પડે છે. ભવિષ્યમાં તક મળશે તો જાણ કરીશું ત્યાં સુધી સૌની ક્ષમા યાચના.

- રજની લટકારી

પરિવાર

શૈલેષ કી દેસાઈ. (ભારતકોર્પોરેશન)

યુનોએ ૧૯૮૪નું વર્ષ પરિવારનું ઘોષિત કર્યું હતું, પણ આપણા સમાજમાં દરેક વર્ષ પરિવારનું જ વર્ષ છે, જ્યાં બાળકોને પ્રથમ સ્થાન અપાય છે, સ્ત્રીઓને બીજું અને પુરુષોને અંતિમ સ્થાન અપાય છે. એ જ ભારતીય વ્યાખ્યા પ્રમાણે પૂર્ણ પરિવાર મનાય છે. જ્યાં પરિવાર માટે ત્યાગ શક્ય છે ત્યાં પારિવારિક સુખી સહજીવન શક્ય છે. સોનિયા ગાંધીએ રાજીવ ગાંધી ને પરણી હિન્દુસ્તાન આવ્યા પછી એમણે એક અચૂક સૂચક વિધાન કર્યું હતું કે અહીં તમારા વ્યક્તિગત પ્રશ્નોનો નિર્ણય કુટુંબ દ્વારા લેવાય છે. જેવા કે સંસ્કારી પરિવારમાં ક્યારે છોકરી પસંદ કરવી, કઈ છોકરી પસંદ કરવી? ક્યાં અને કેવી રીતે લગ્ન કરવા? ક્યારે છોકરા પેદા કરવા? એ છોકરા કે છોકરીનું નામ શું રાખવું? આ બધા જ પ્રશ્નો કુટુંબ જ નક્કી કરે છે.

દરેક જીવ માત્ર ઈચ્છે છે કે પોતાને એક ઘર હોય અને સફળ લગ્ન જીવન હોય. જેમાં એક સ્ત્રી અને બાળક હોય. K.K.Birla એ પણ પોતાના પુસ્તકમાં લખેલું કે A Bird Needs Nest પરિવારમાં પોતાની ઈચ્છાનો ત્યાગ, સર્મપણ કરી છુટવાની ભાવના, નિસ્વાર્થ પણે બિનશરતી ઘસાવવાની ઈચ્છાથી પરિવારની જાળ રચાય છે.

મારા માબાપે કરેલા મારા ઉછેર કરતાં મારા બાળકોનો ઉછેર વધુ સારી રીતે કરીશ, જે જોઈતું હશે તે મારી જાત પર કરકસર કરીને પણ લાવી આપીશ, શ્રેષ્ઠ શાળાને કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ આપીશ, તેમના પર કામનો બોજો નહીં પડવા દઈશ, જ્યાં જવું હશે ત્યાં લઈ જઈશ, બધી જ યોગ્ય સુવિધા આપીશ, મેં જે સહન કર્યું તે તેઓને સહન ન કરવું પડે તેની કોશીષ કરીશ.

આંખ ભરઆઈ અગર, અશ્કોકો મેં પી લૂંગી..

આહ નિકલી જો અગર, હોઠ કો મેં સી લૂંગી.

આ નિર્ણયો પાર પાડવા માબાપ સારી એવી બધીજ કોશીષ કરે છે પણ ઘણીવાર ટીનએજસૌ સંતાનો અસંતોષ અનુભવે છે. વાક્યુદ્ધ કે તફડા તફડીથી ચર્ચા કરે છે. બોલવાનો વ્યવહાર પણ જરૂર પૂરતો જ રાખે છે. તેવું શા માટે બને છે? પેઢીગત અંતર-જનરેશન ગેપને લીધે અચૂક અમૂક નાની મોટી સમસ્યાઓ ઉત્પન્ન થાય તે સૈકાઓ જૂની બાબત છે. પણ છેલ્લા વર્ષોમાં જીવન શૈલી, (કોમ્પ્યુટર, મોબાઈલ) મૂલ્યો, સંજોગો ને ફેશનને અગ્રતાક્રમ આપવામાં આવે છે. જેથી સંઘર્ષો વધ્યા છે. આજના બાળકો ત્રણ જીવન આવશ્યક પ્રત્યે સભાન નથી રહેતા જેવા કે શારિરિક સ્વાસ્થ્ય પ્રત્યે, ધનના સંચય પ્રત્યે ને બ્રાન્ડેડ વસ્તુઓ જ વાપરવાની ઘેલછા પ્રત્યે. આજના સંતાનોને શિખામણ મણભાર જેવી લાગે છે. મુંઝાયેલી પરિસ્થિતિમાં મિત્રો કે સહઅઘાયી અનિચ્છનીય વર્તણુક કરે છે. ઉપાય એ જ કે સૂચનો કે રોકવાને બદલે શક્ય દેખરેખ રાખવી. નાની બાબતોમાં સલાહ ન આપવી તો એકમેક પ્રત્યેનો આદર વધશે. તેમાં શંકા નથી, બે પેઢી વચ્ચેની ખાઈને ઊંડી બનતા રોકવા પૂ. ભૂપેન્દ્ર પંડ્યા, એ પાલક સંતાનોને કુટુંબ માટે ચાર વસ્તુઓ કરવા સૂચવી છે. પ્રથમ સહ ભોજન, ટી.વી. સાથે બેસી જોવું, છાપા પુસ્તકોને સામાયિકો સાથે બેસીને વાંચવાને બહારગામ જવાનું થાય તો સાથે જવું જેથી મૈત્રીભાવ કેળવાય છે.

સંયુક્ત કુટુંબમાં,

સાથે રહેવાનું પણ સાથે નથી રહેતા તેમ રહેવાનું.

બને તેટલી બાબતો પ્રત્યે આંખ આડા કાન કરવા, અલગ અલગ ફ્લેટમાં રહેતા હોય તેમ માની નાની નાની બાબતોમાં સલાહ ન આપવી, આજે તો નોકરોને પણ રોકટોક ગમતી નથી. દરેક વ્યક્તિને કામ કરવાની રીત ને આદત-સ્ટાઈલ અલગ અલગ હોય છે જેમ કે વસ્તુ વાપર્યા પછી ત્યાંજ રાખવી કે જ્યાંથી વાપર્યા પૂર્વે જ્યાં હતી ત્યાં મૂકવી, જમ્યા પછી થાળી ત્યાં જ રાખવી કે ધોવાના બેઝીનમાં મૂકવી વગેરે વગેરે.

પરિવાર એક દાંતવાળા ગીયરની માફક ચાલે છે. લગ્નનું નાનું ગીયર પરિવારના મોટા ગીયરને ફેરવે છે. બન્ને એકી દિશામાં ફરતા ઊર્જા ઉત્પન્ન કરે છે. હૂંફ લાવે છે. દુનિયા જે ધક્કા મારે છે, તેના માટે પરિવાર (Shock Abstrak) સહન શક્તિ કેળવે છે. પૂરા પરિવારનું મધ્યબિંદુ માતામાં સ્થિત થયેલ હોય છે યા કહો કે પૂરા પરિવારની ગ્રીનસ્વીચ મીન ટાઈમ રેખા માતામાંથી પસાર છે. પરિવાર કે સંયુક્ત કુટુંબની સફળતામાં એક સ્ત્રીનો બહુ મોટો હિસ્સો હોય છે. કેમ કે તેની સમજશક્તિ, સહનશક્તિ, વ્યવસ્થા કુનેહ, હોંશિયારી, કરકસરતાં, ફાવશે, ભાવશે ને ચાલશે કે ચલાવી લેવાનું શિક્ષણ કુટુંબને તારે છે. ઈંગ્લેન્ડમાં ચાર વાગે અંધારુ થાય છે માટે દરેક ઘરો કાચના હોય જેથી મોડે સુધી પ્રકાશ ઘરમાં આવે તેમજ ઠંડી માં રક્ષણ મળે. કદાચ પરિવારની સમાજમાં આજ ઉપયોગીતા છે.

ઈઝરાઈલીઓ - યહુદીઓની સંખ્યા માત્ર ૯૦ લાખની છે છતાં બે કરોડ મુસ્લીમો સામે ટકી રહ્યા છે. એલેક્ઝાન્ડર મેલી ખોવના કહેવા પ્રમાણે રાષ્ટ્રીય એકતા કે પારિવારીક એકતા માત્ર કલેક્ટીવ ફેન્ટમ, થકી હાંસલ થાય છે. કલેક્ટીવ ફેન્ટમ એટલે સામૂહિક સમુહમાં જીવનાર પ્રજા વધુ મજબૂત થાય છે. Michel - Frayan ના પુસ્તકોમાં લખ્યું છે. The Human Touch, is a Part In Creation of Universe. સંયુક્ત કુટુંબ અને પરિવાર થકી Human Touch વધે છે. જેના થકી જીવન સજ્જ બને છે.

પરિવાર એ કોઠા યુદ્ધ છે. જેમાં દરેક સભ્યને લડવાનું હોય છે જે સમર્થ થવા માતાની કુખ અને પિતાનો પ્રેમ અનિવાર્ય છે. ગુરુ પાતાંજલિ એ કહ્યું છે કે યોગ એ એક કનેક્ટીંગ લીંક છે જે પરિવારમાં રહેવા બધા સભ્યોને સમર્થ બનાવે છે ને કોઠા યુદ્ધ માટે સજ્જ કરે છે.

તેમનામાં Pure Awareness & Pure Intelligence આવે તો જીવનની સમગ્ર તકલીફો લડવા સમર્થ બનાવે છે.

પરિવારને ડાઈનીંગ ટેબલ જ નજદીક લાવે છે. સહુ ભોજનથી હૂંફ, ઊર્જા. Vibration, એકતાની ભાવના, ચર્ચા, વિચારણા ના જાણ્યું. અજાણ્યું જાણવા મળે છે. આનું ટેબલ પતિ પત્નીને બહુ નજદીક લાવે છે. પ્રાણ પ્રશ્નોનું નિવારણ લાવે છે. અહીં ફી ક્ષણોમાં માનસિક રાહત અનુભવાય છે. Routines વિચારો કરતાં નવી દિશામાં વિચારવાની તક મળે છે. દુનિયાનો કોઈ જીવ પોતાના લોકોથી રચાયેલા બચ્ચાઓને તરફોડી શકતું નથી. હાલ ગુજરાત સમાચારમાં આવેલું કે છુટ્ટુ પડી ગયેલું વાઘણનું બચ્ચું, વાઘણને ન મળતાં જેટલા માણસો તેની નજરમાં આવ્યા તે બધાને ફાડી નાખ્યા હતા.

પ.પૂ.આ.ભ.શ્રી રાજરત્નસૂરશ્વરજી એ પર્યુષણ દરમ્યાન વાખ્યાન કરતા બહુ સરસ જણાવેલું કે સફળતા પૂર્વક પરિવાર ચલાવતા કે સંયુક્ત કુટુંબમાં,

હસતા હસતા સહેતા રહેજો...

સહતા સહતા હસતા રહેજો...

પરિવારની ઝંખનામાં ગાયક કિશોર કુમારે ચાર પત્ની કરી, પહેલીનું કુદરતી અવસાન બાદ રુમાદેવીથી આવેલ પુત્ર અમીતકુમારનો ઉછેર કરવા ને ઘરનું ધ્યાન રાખવા, મધુબાલા સાથે લગ્ન કર્યા, જેને કેન્સરની દર્દનાક, અસહ્ય પીડાથી રડતી અને ચીસો પાડતી (તે સમયમાં કેમોથેરોપીની શોધ થઈ ન હતી) ત્યારે તેને હસાવવા કિશોરકુમાર પશુ-પક્ષીઓના અવાજ મીમીકી તથા પલંગની આજુબાજુ ડાન્સ (ઉડલે ઉડલે ઓઉ) કરી હસાવતા હસાવતા ફિલ્મી જગતમાં શ્રેષ્ઠ કોમેડીયન થઈ ગયો. તેના મરણ બાદ યોગીતા બાલીએ પોતાની માતાને ઘરમાં સાથે જ રાખવાની અવ્યવહારીક જીદને કારણે, જાકારો મળ્યો. છેવટે ચોથી લીના ચંદાવલકર સાથે સ્થાઈ થયો. ફિલ્મી જગતમાં એક સ્ટાર ને સ્ત્રીઓની કમી નથી હોતી. પણ તેને સ્ત્રી કહી પરિવાર સંચાલકની જરૂર હતી. શરૂમાં જણાવ્યા પ્રમાણે પરિવાર એટલે એક સ્ત્રી એક બાળકને એક ઘર હોય છે.

નિષ્ફળ લગ્ન જીવનબાદ રાજેશ ખન્નાએ પોતાની તમામ ૨૦૦ કરોડની જંગી સંપત્તિ બે પુત્રીઓને જ નામે જ કરી. એટલું ઓછું હોય તેમ છેલ્લે પંખીની એડ્વરટાઈઝના આવેલા રૂ. ૮૦ લાખ પુરા બન્ને પુત્રીઓને જ આપી દીધા. આગળલખ્યા મુજબ પોતાના લોકોથી રચાયેલા બચ્ચાને કોઈ તરછોડી શકતું નથી.

ફક્ત ૩૫ વર્ષની વયમાં બન્ને પત્નીઓનું કુદરતી અવસાન બાદ ઘનશ્યામદાસ બિરલાને ગાંધીજીએ ઈશ્વર ઈચ્છા માથે ચઢાવવા જણાવ્યું. ત્યારબાદ પોતાના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ, વ્યવહાર, વર્તન, વાત્સલ્ય, કેળવણીને પ્રેમનુ સીંચન પત્રવ્યવહારથી કર્યું. (ઠેર ઠેર ઉદ્યોગોને કારણે ઘરની બહાર વધારે રહેવું પડતું) તે તમામ પત્ર વ્યવહાર, આજે G.D.Birla ની બુક્સમાં સમાયેલા છે.

પુત્રની ઝંખનામાં શ્રી જવાહરલાલ નહેરુને જ્યારે જ્યોતીષે કહ્યું કે પુત્રયોગ નથી, ત્યારે તેમણે ઉત્તરાખંડ, હરિદ્વાર ને ઋષીકેશના તમામ મંદિરોમાં જઈ બાંગ પોકારતા પ્રાર્થના કરતા કે હે પ્રભુ મને ભલે પુત્રયોગ ન હોય તો એક પુત્રી આપ, જે વિશ્વમાં નામ કરે પછી શું થયું તે જગજાહેર છે. પણ વિશેષ એટલું જ લખવાનું કે જ્યારે શ્રીમતી ઈન્દિરા ગાંધીનો અગ્નિસંસ્કાર થયો ત્યારે દુનિયાના તમામ V.I.P. ઓએ હાજરી આપી એવી શ્રદ્ધાંજલી આપીકે મુંબઈ સમાચારના જણાવ્યા પ્રમાણે આકાશમાંથી નીહાળતા દેવી દેવતાઓને પણ ઈર્ષા આવે. પોતાની પુત્રીને એક હુંફ માટે તેઓ દરેક મીટીંગમાં તેમ જ વિદેશયાત્રામાં પોતાની સાથે રાખતા, જેમાંથી શ્રીમતી ઈન્દિરા ગાંધી રાજકારણના તમામ દાવપેચ શીખી ગયા, ને World Best Politician બન્યા.

લેમીગટન રોડ પર આવેલા 'નાઝ' સિનેમા પાસે પોકેટ રેડીઓ વેંચનાર મનુષ્યાબરીઆ દુબઈ જઈ સ્થાઈ થયો ને ફક્ત ૫૪ વર્ષની વયે હાર્ટએટેક થી અવસાન

માપ્યો ત્યારે ૩૦,૦૦૦ કરોડનું સામ્રાજ્ય ને ત્રણ પુત્રીઓ મુક્ત ગયા. દુનિયાને દારૂ બનાવીને પીવડાવનાર મનુષ્યાબરીયાએ કદી દારૂને સ્પર્શ કર્યો ન હતો. નિયમિત ઘોડાની રેસ જોનારા કદી પોતે બેટીંગ્સ નહતી કરી. ફરી અહીં એક હુંફ માટે પોતાની પત્નીને હંમેશા મીટીંગ્સમાં તેમજ વિદેશયાત્રામાં સાથે જ ફરતાં ફરતાં તેઓ Business માં એવા Expert થઈ ગયા કે Corporate World માં Ladies માં Best Administrater તરીકે તેમનું ત્રીજું સ્થાન છે.

કહેવાય છે કે બુદ્ધિજીવી સંસ્કારી પતિ-પત્નીઓમાં ઝઘડો ન થાય કે અસંહિષ્તા ન આવે કે ગેરસમજ ન થાય તે વાત્સવિકતાથી દૂર છે. સવાલ છે માટે Solution નો. જે માત્ર ૨૪ કલાકમાં લેવાય તો ઝઘડાના રણમાં મીઠી વીરડીના નીતરતા પાણી પી શકાય જેમાં પૂરી સમજદારી અને પૂરી વાત્સવિકતા છે. બીજી પરિવારની સમસ્યાના ઉકેલમાટે પતિ-પત્નીની સહિયારી જવાબદારી છે. ત્રીજી તાત્કાલીક ઉકેલ ન આવે તો ઝેરના બીજ રોપાય છે. જેથી કડવાશ કટુતા વધે ને એક મેકથી દૂર થવાની ભાવના વધુ ને વધુ પ્રબળ થાય. ચોથું એકબીજાના દોષારોપણ કરવાથી સંબંધોની સુગંધ ઊડી જાય છે. તેથી ઉલટું સંબંધોની સુગંધ ઊડી ન જાય તે બન્નેએ જોવાનું છે. જે પછી આનંદ ઘટી જાય છે જેમ ઘર અને ઘરનો ઉંબરો રોજ સફાઈ કરીએ છીએ. તેમ જીવનના ચોપડાઓમાં ગુંચ ગેર સમજની શુદ્ધિનો રોજ આગ્રહ રાખવો. ચિંતકો કો એટલે સુધી કહેતા કે ચા નું ટેબલ ડાઈનીંગ ટેબલ એક ઓક્સીજન છે જેમાં પરિવારની શાંતિ સુખ આનંદ હાથવેંતમાં સહજ બનતા હોય છે. ચાના પ્રેમીઓ વાતો મમળાવતા મમળાવતા અનેક સમસ્યાનો ઉકેલ Solution લાવી શકે છે.

૫૦ વર્ષની આસપાસ પત્નિનું અવસાન થતાં પ્રશ્ન હુંફનો હોય છે (શારિરીક) ભૂખનો નહિ. ઘરમાં કોઈ ફીકર કરવાવાળું હોય, રાહ જોવા વાળું હોય, જલ્દી ચા

બનાવ તો એવું કોઈ આપણુ સાંભળવા વાળુ હોય, જમતા હજું થોડું લેવાઈ જશે, તો બસ, આટલું જ તો લેવું પડશે. જો સાંજે કામ જલ્દી પૂરું થાય તો જલદી આવજો કામે જતાં બધુ બરોબર લેવાયુ છે ને પોકેટ, મોબાઈલ કંઈ ભુલી નથી ગયાનો ભલે ઉતાવળ હોય ચા તૈયાર છે પીને જ જવાનું છે. એવા કહેણમાં એક ખેંચાણ હોય છે માટે જ પત્નીના મરણની ખોટ પુરાતી નથી. ત્યારે કોઈ બીજા લગ્ન કરે છે.

પરિવારના પીઠબળ પૂર્વે પ્રગતિ પાંગળી છે. R.D.Birla (બોમ્બે હોસ્પિટલ, બિરલા માતૃશ્રી સભાગૃહ, સેંચ્યુરી મીલ જેવા અનેક ફેક્ટરી તેમજ ઉદ્યોગોના સ્થાપક) પરિવારમાં તેમના પરણિત પુત્રે ટાઈપીસ્ટ સાથે અનૈતિક સંબંધ લગ્ન કરતા ૧૭૫ થી વધુ બહોળા પરિવારે સર્વ સંમતિથી જાકારો (Getout) આપ્યા બાદ તેઓ એક ગંજીફાની ફેક્ટરી પણ શરૂ ન કરી

શક્યા. તેમજ સમગ્ર પરિવારના નિસાસાથી ટૂંક સમયમાં અવસાન પામ્યા.

કડક સ્વભાવના કારણે પરિવાર તૂટે છે. જેમ કે, દાંત કડક છે, માટે જ તે તૂટે છે.

જીભ નરમ છે કેમ કે તે વળે છે,

તીર છોડતા પૂર્વે કમાન નમે છે.

પૌઢ એવા ફળ, ફુલ ને પાંદડા નમે છે.

સાવધાની માટે ચોર પણ નમે છે.

આક્રમણ પૂર્વે ચિત્તો પણ નમે છે

સૂર્ય તેજ છે માટે તેની સામે કોઈ જોતું નથી.

તેજ સ્વભાવવાળાને કોઈ પુછતું નથી.

છેલ્લે પરિવારની સફળતા પૂર્વક સંચાલન માટે સ્વભાવમાં નમ્રતા, વિવેક, બુધ્ધિ, સહજતા, સરળતા ને LETGO ની ભાવના આવશ્યક છે.

શ્રી બાલાસિનોર નવયુવક સંઘ સંસ્થા સમાચાર

શ્રી બાલાસિનોર નવયુવક સંઘની ૪થી બેઠક તા. ૧-૧૦-૨૦૧૩ના રોજ મંગળવારે સાંજે ૬.૪૫ કલાકે સંસ્થા પ્રમુખ શ્રી કલ્પેશ ધારીઆના નેજા હેઠળ શ્રી મોહનલાલ સાંકરલાલ શાહ (ઝાટ) સભાગૃહ (સંસ્થાની ઓફીસ) ખાતે મળી હતી.

તેમા નીચે મુજબના મુદ્દાઓ હાથ ધરાયા હતા.

સંસ્થાના સહમંત્રી શ્રી જાસ્મીન શેઠ એ ગત મીટીંગનો અહેવાલ રજૂ કર્યો હતો તે સર્વાનુમત્તે પસાર કરવામાં આવ્યો હતો.

ક્રિકેટ સમિતિના સંયોજક શ્રી ચીરાગ પરીખે એમનો અહેવાલ રજૂ કર્યો હતો તે જણાવ્યું હતું કે જનસાથી ટુરનામેન્ટ તા. ૧૯-૧૦-૨૦૧૩ના રોજ થી ચાલુ થશે અને તેમા કુલ ૪ ટીમો રમશે, વધુમા તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે બીપીએલ ટુરનામેન્ટ યોજવાનું નક્કી કર્યું છે. તેનો વિગતવાર અહેવાલ આગામી કાર્યવાહક સમિતિમા આપશે.

- ઈન્ડોર ગેમ્સના સંયોજક શ્રી સંજય શાહ તેમની મુંબઈ ખાતે રમાયેલી રમત-ગમત (કેરમ અને ચેસ)ના વિજેતાઓના નામની જાહેરાત કરી હતી.

શ્રી રજનીકાન્ત કાંતિલાલ કડકીઆ (ધરીવાલા) પુરસ્કૃત વાર્ષિક રસોત્સવના સંયોજક અનુપસ્થિત હોવાથી તેમનો અહેવાલ સંસ્થાના ઉપપ્રમુખ તથા કો.ઓરડીનેટર શ્રી સૌમીલ મોદીએ રજૂ કર્યો હતો. તેમને ઓડીશન માટેની તારીખ ૨-૧૦-૨૦૧૩ જાહેર કરી હતી તથા ઓડીશન માટે જગ્યા ફાળવવા માટે શ્રી સુનીલ મોદી (ઠાસરાવાલા)નો આભાર માન્યો હતો, બીજું તેમને ટીકીટોનું વિતરણ તથા વેચવાના સ્થળની જાહેરાત કરી હતી.

કુલ ૬ લીવની અરજી આવી હતી તે પસાર કરવામાં આવી હતી.

પ્રમુખશ્રીએ આભાર માની સભા બરખાસ્ત જાહેર કરી હતી.

મંત્રી : શ્રી ભાવેશ બીપીન મોદી.

શ્રી બા.ન. સંઘ સંચાલિત શ્રીમતી શાંતાબેન કાંતિલાલ દોશી પુરસ્કૃત મહિલા વિભાગ

સ્નેહ સંમેલન તા. ૧૨-૧૧-૨૦૧૩ને મંગળવારે બપોરે ૨.૩૦ કલાકે તેજપાલ ઓડિટોરીયમમાં Musical Orchestra રાખવામાં આવ્યો છે. આપણા સ્નેહ સંમેલનમાં અમૂલ્ય ફાળો આપનાર છે 'પુષ્પાબેન નવીનચંદ્ર પરીખ' સંસ્થા તેમનો તથા તેમના પરિવારજનોનો આભાર માને છે.

સંયોજક : પ્રતિમા કિરીટ ધારીઆ -

૯૮૨૦૧૫૨૬૪૪

આપણે બે

ભલે ઝગડીએ ક્રોધ કરીએ,

એક બીજા પર તુટી પડીએ

એક બીજા પર દાદાગીરી કરવા

છેલ્લે તો આપણે બેજ હોઈશું.

જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,

એક બીજાના ચોખટા શોધવા,

છેલ્લે તો આપણે બેજ હોઈશું.

હું રિસાઈશ તો તું મનાવજે,

તું રિસાઈશ તો હું મનાવીશ

એક બીજાને લાડ લડાવવા

છેલ્લે તો આપણે બેજ હોઈશું.

આંખો જ્યારે ઝાખી થશે, યાદ શક્તિ પણ પાખી થશે
ત્યારે એકબીજાને, એકબીજામાં શોધવા

છેલ્લે તો આપણે બેજ હોઈશું

ઘુટણ જ્યારે દુખશે, કેડ પણ વળવાનું મુકશે

ત્યારે એક બીજાના પગના નખ કાપવા

છેલ્લે તો આપણે બેજ હોઈશું.

મારા રીપોર્ટ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલ રાઈટ

એમ કહીને એક બીજાને છેતરવા

છેલ્લે તો આપણે બેજ હોઈશું.

- સંકલન

શ્રી બાલાસિનોર નવયુવક સંઘ
શ્રી રજનીકાંત કાંતીલાલ કડકીઆ (ધરીવાળા) પુરસ્કૃત ૬૨મો વાર્ષિક રસોત્સવ
આપણી જ્ઞાતીના ભાઈઓ, બહેનો દ્વારા યોજેલ રંગારંગ કાર્યક્રમ

‘મન મોર કરે કલશોર’

સાથે

દાતાઓનો સત્કાર સમારંભ

તા. ૧૭-૧૧-૨૦૧૩, રવિવાર

સમય : સવારે ૯.૦૦ કલાકે

સ્થળ : બિરલામાતુશ્રી સભાગૃહ, મરીન લાઈન્સ

ટિકિટનું વેચાણ તા. ૧૦-૧૧-૨૦૧૩, સમય સવારે ૯ થી ૧૧ કલાકે

નીચે જણાવેલ સ્થળ પરથી ટિકિટો મળશે.

૧) શ્રી બાલાસિનોર પ્રગતિ સમાજ

૪૫/૪૯, બાલકૃષ્ણા કો.ઓ.બાબુગેનુ રોડ, કાલબાદેવી, મુંબઈ - ૨

૨) વાંદરા થી ગોરેગાવ - હિમાંશુ હરીશચંદ્ર દેસાઈ (દેડકી)

૯/૧૨, ઘાસવાલા બિલ્ડીંગ, રૂમ નં. ૫, પોલીસ સ્ટેશનની સામે, એસ.વી.રોડ,
અંધેરી (ઈસ્ટ), મો.: ૯૮૨૧૦૨૦૮૮૮૧

૩) મલાડ થી કાંદિવલી : કોકીલાબેન હીરાલાલ પરીખ (ડાબલી)

એ-૨૪, કૈલાશ નગર, શંકરગલી, કાંદિવલી (વેસ્ટ), નિમિશ ગાંધી - ૯૮૨૧૧૬૪૭૩૧

૪) બોરિવલી થી વિરાર : હેમેન્દ્ર રમણલાલ શાહ (ચકવા)

સી-૩૦૨, સુમેર નગર, એસ.વી.રોડ, બોરિવલી (વેસ્ટ) મો. ૯૮૨૦૦૧૧૫૮૬

નોંધ : વ્યક્તિ દિઠ બે ટિકિટ આપવામાં આવશે. ટિકિટનું વિતરણ પહેલા તે વહેલા ધોરણે થશે.

પ્રોગ્રામ અચૂક ૯.૦૦ કલાકે ચાલુ થશે.

આ કાર્યક્રમ માણનારાનો આનંદ જળવાઈ રહે માટે સૌ આમંત્રિત અને

પ્રેક્ષકોને સમયસર હાજર રહેવા નમ્ર વિનંતી.

મંત્રી : શ્રી ભાવેશ મોદી

રસોત્સવ સંયોજક : શ્રી સમીર ગાંધી

ઉપપ્રમુખ તથા કોઓરડીનેટર : શ્રી સૌમિલ મોદી.

બાલાસિનોરગ્રાહક સહકારી મંડળ લી. - ખુશ ખબર

૨, ગણેશકૃપા સોસાયટી, શીખા નગર, વી.પી.રોડ, મુંબઈ- ૪૦૦૦૦૪, ફોનન. : ૨૩૮૮૭૭૮૮/૨૩૮૮૬૧૧૮
આથી સર્વે શેર હોલ્ડર/ગ્રાહક બંધુઓને જણાવતા હર્ષ થાય છે કે ચાલુ વર્ષે પણ દિવાળીમાં સૂકા મેવાના યુનીટો તેમજ મીઠાઈઓ બનાવવાના છે. તો આપ સૌ જરૂરથી આપની જરૂરીયાત મુજબ ઓર્ડર નોંધાવશો.

	આખા યુનીટ	અડધા યુનીટ
બદામ અમેરીકન	૫૦૦ ગ્રામ	૨૫૦ ગ્રામ
કાજુ આખા	૫૦૦ ગ્રામ	૨૫૦ ગ્રામ
કાજુ ખારા	૫૦૦ ગ્રામ	૨૫૦ ગ્રામ
કીસમીસ (સુકી) દેશી	૫૦૦ ગ્રામ	૨૫૦ ગ્રામ
પીસ્તા (ખારા)	૨૦૦ ગ્રામ	૧૦૦ ગ્રામ
અખરોટ (મગજ)	૨૦૦ ગ્રામ	૧૦૦ ગ્રામ
સ્પે. નટસ મીક્ષ ચોકલેટ	૨૦૦ ગ્રામ	૧૦૦ ગ્રામ

આખા યુનીટનો દર રૂ. ૧૭૩૦/- અડધા યુનીટનો દર રૂ. ૮૭૦/-

સૂકા મેવાના છુટક ભાવ (એક કિલોનો) વેચાણ માટે

અમેરીકન બદામ	૭૦૦.૦૦	પીસ્તા મોળા	૧૪૦૦.૦૦
કાજુ આખા	૭૨૦.૦૦	પીસ્તા ખારા	૮૨૦.૦૦
કાજુ ચાર ટુકડા	૫૫૦.૦૦	અખરોટ મગજ	૧૧૦૦.૦૦
કાજુ ખારા	૮૦૦.૦૦	અંજીર	૬૨૦.૦૦
કીસમીસ (સુકી) દેશી	૩૨૦.૦૦	જરદાલુ	૫૧૦.૦૦
સ્પે. બદામ પિસ્તા કેસર મીક્ષ ચોકલેટ	૩૦૦.૦૦		

(સ્ટોક મર્યાદિત હોવાથી માલ હશે ત્યાં સુધી મળશે)

ચેરમેન: પ્રવિણભાઈ ઓચ્છવલાલ દેસાઈ (દેડકી)

પ્રમુખ: યોગેશ આર. ધારીઆ

માનદ્ મંત્રીઓ: જગદીશ શાંતીલાલ પરીખ (જુનાગઢવાળા),

શિરિષ જગમોહનદાસ પરીખ (ચાગરમ)

સફેદ કાજુ કતરી રૂ. ૪૮૦/- કિલો. કેસરી કાજુ કતરી રૂ. ૫૨૦/- કિલો.

બુંદી લાડુ (બદામ-પીસ્તા-કેસર) રૂ. ૩૦૦/- કિલો. મોહનલાળ રૂ. ૩૨૦/- કિલો. કોપરા પાક રૂ. ૩૦૦/- કિલો

તા.ક. ૧) દિવાળી નિમિત્તે બધીજ મીઠાઈઓનો ઓર્ડર તા. ૧૫-૧૦-૨૦૧૩ થી ૩૦-૧૦-૨૦૧૩

સુધી નોંધવામાં આવશે. તા. ૨-૧૧-૨૦૧૩ સુધીમાં રિલીવરી સ્ટોર્સ પરથી લઈ લેવી.

૨) બધીજ મીઠાઈઓ પ્લાસ્ટિકના બોક્સમાં આપવામાં આવશે.

૩) સૂકોમેવો તથા બધીજ મીઠાઈઓની કુલ કિંમત રૂ. ૧૫૦૦/-ની ખરીદી પર રૂ. ૬૦/- તેમજ

રૂ. ૨૫૦૦/-ની ખરીદી પર રૂ. ૮૦/- સુધીની સ્ટોરમાંથી નક્કી કરેલી આઈટમ ફ્રી આપવામાં આવશે.

ઘર વપરાશની વસ્તુઓ વ્યાજબી દરે રૂ. ૧૫૦૦/- ની ઉપરનાં ઓર્ડર હોય તો

ઘર બેઠા ફ્રી હોમ ડીલીવરી કરવામાં આવશે.

અમોને જણાવતા હર્ષ થાય છે અનાજ તથા બીજી પરચુરણ આઈટમનો ઓર્ડર્સ એક સંસ્થા તરફથી રૂ. ૮ લાખનો મળેલ છે. દરેક બાલાસિનોર વાસીઓને વિનંતી કે આપ સૌપણ સંસ્થાને તમારો અમૂલ્ય ઓર્ડર આપતા રહેશો.

શ્રી વાડાસિનોર દશાનીમા નવયુવક મંડળ તથા મેડીકલ ટ્રસ્ટ

ઉપરોક્ત મંડળની ૮૫મી અને ટ્રસ્ટની ૩૪મી વાર્ષિક સામાન્ય સભા તા. ૨૦-૯-૨૦૧૩ના શુક્રવારે સાંજે ૭.૩૦ કલાકે હિન્દી વિદ્યા ભવન, મરીન ડ્રાઈવ, મુંબઈ - ૨૦ ખાતે પ્રમુખ શ્રી દક્ષેશ બાબુલાલ કડકીઆના પ્રમુખ પદે મળી હતી. જેમાં સહી બુકમાં કર્યા મુજબ ૧૯૬ સભ્યો હાજર રહ્યા હતા. પ્રમુખશ્રીએ સૌને આવકાર આપી સભાનું કામકાજ શરૂ કર્યું હતું. ગત વાર્ષિક સામાન્ય ૮૪મી મંડળ અને ૩૩મી ટ્રસ્ટની મીનીટસ પસાર કરવામાં આવી હતી.

મંડળ તથા ટ્રસ્ટના વાર્ષિક હિસાબી નિવેદનો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. મંડળ તથા ટ્રસ્ટની બુકલેટમાં છાપેલ વાર્ષિક અહેવાલ (મંત્રી નિવેદન) સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. ઓડીટર્સ તરીકે મે. જે.એમ.એસ. એન્ડ કું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની માનધન વગર સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી.

સભ્યો તરફથી આવેલા સૂચનો પર ચર્ચા વિચારણા અને પ્રમુખશ્રીના ટૂંકા ભાષણ બાદ સભા બરખાસ્ત કરવામાં આવી હતી.

વાર્ષિક સામાન્ય સભા પૂરી થયા પછી તરત જ પહેલી કારોબારીની બેઠક મળી હતી. જેનું પ્રમુખ સ્થાન શ્રી કલ્પેશ સુ. ધારીઆએ સ્વીકાર્યું હતું.

મંડળ તથા ટ્રસ્ટના હોદ્દાઓ તથા કન્વીનરની નિમણૂક કરવામાં આવી હતી, જે નીચે મુજબ છે.

પ્રમુખ : શ્રી દક્ષેશ બા. કડકીઆ (લટકારી)
 ઉપપ્રમુખ: શ્રી પંકજ કા. ધારીઆ (લાલખા)
 શ્રીમતી સોહીણીબેન વાય. કડકીઆ
 મંત્રી : શ્રી પરેશ આર. પરીખ (દૂધવાળા),
 શ્રી કીરીટ આર. ધારીઆ
 ખજાનચી: શ્રી નિમિષ મ. કડકીઆ,
 શ્રી મંજુલ શૈ. ધારીઆ (હેડમાસ્ટર)

- (૧) શ્રી રજનીકાંત કે કડકીઆ (લટકારી)
કન્વીનર : આર્થિક રાહત યોજના
- ૨) શ્રી વિરેન્દ્ર ક. ગાંધી (સુરતી)
કન્વીનર : અપલીફ્ટમેન્ટ ઓફ સોસાયટી યોજના
- ૩) શ્રી કીર્તી હી. કડકીઆ : કન્વીનર મેમ્બર્સ રીલેટેડ
- ૪) શ્રી મીનીષ બા. કડકીઆ
કન્વીનર : મુક્તીધામ યોજના
- ૫) શ્રી કૌશીક કા. કડકીઆ
કન્વીનર : મેડીકલરીલીફ યોજના
- ૬) શ્રી ઉષનસ ન. કચેરીઆ
કન્વીનર : ગર્વનીંગ કાઉન્સીલ
- ૭) શ્રી ડૉ. અક્ષય દી. સેવક : સુપ્રીન્ટેન્ડન્ટ
- ૮) શ્રીમતી કીર્તી અ. સેવક : એડમીનીસ્ટ્રેટર
માનદ્ મંત્રીઓ
શ્રી પરેશ આર. પરીખ , શ્રી કીરીટ આર. ધારીઆ

શ્રી બાલાસિનોર પ્રગતિ સમાજ

શ્રી બાલાસિનોર પ્રગતિ સમાજની ૪૫મી વાર્ષિક સામાન્ય સભા

શ્રી બાલાસિનોર પ્રગતિ સમાજની ૪૫મી વાર્ષિક સામાન્ય સભા તા. ૨૦-૯-૨૦૧૩ શુક્રવારે સાંજે ૬.૪૫ કલાકે સંસ્થાના પ્રમુખ શ્રી નિમિષ કડકીઆ (મલમ)ના નેજા હેઠળ હિન્દી વિદ્યા ભવન (મરીન લાઈન્સ) ખાતે મળી હતી.

તેમા નીચે મુજબના મુદ્દાઓ હાથ ધરાયા હતા. સંસ્થાના મંત્રી શ્રી રાજેન્દ્ર દેસાઈએ ગત ૪૪મી વાર્ષિક સામાન્ય સભાની કાર્યનોંધનું વાંચન કર્યું હતું, અને ઠરાવ દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

સંસ્થાના મંત્રી શ્રી રાજેન્દ્ર દેસાઈએ ગત વર્ષના કાર્યનો અહેવાલ રજૂ કર્યો હતો. જેને ચર્ચા વિચારણા બાદ સર્વાનુમતે પસાર કરવા આવ્યો હતો.

સંસ્થાના ખજાનચી શ્રી રાજુલ પરીખે વર્ષ ૨૦૧૨-૨૦૧૩નો હિસાબ રજૂ કર્યો હતો તે સર્વાનુમતે ઠરાવ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો.

વર્ષ ૨૦૧૨-૨૦૧૩ માટે સંસ્થાના ઓડીટર તરીકે આઈ.ઓ.ધારીઆની નિમણૂક કરવામાં આવી હતી. તે સર્વાનુમતે ઠરાવ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. જેમાં તેમનું માનદ્ મહેનતાણુ નક્કી કરવાની સત્તા કારોબારીને આપવામાં આવી હતી.

યુંટણી અધ્યક્ષ શ્રી કિરિટ કડકીઆ (મલમ)એ એમનો અહેવાલ રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે કુલ ૫ ખાલી પડેલ બેઠક માટે કુલ ૨ અરજી આવી હતી તે પસાર કરવામાં આવી હતી. બાકીની ત્રણ બેઠક ૧ લી કારોબારીની બેઠકમાં ભરવાની સત્તા લેવામાં આવી હતી.

આમંત્રિત અને હાજર રહેલા સભ્ય શ્રી રસીકલાલ મોદી(દેવ), શ્રી વસંતભાઈ પરીખ, શ્રી કલ્પેશ ધારીઆ અને શ્રી નિતિન ગાંધીએ દબાણ પૂર્વક સુચન કર્યું હતું કે વધુ ને વધુ સંસ્થાનું એકીકરણ કરી સંસ્થાના બીજા સામાન્ય ખર્ચા ઉપર કાપ મુકી અને જરૂરીયાતવાળા કુટુંબોને વધુ સહાય કરવી અને આનાથી આપણી ચાલતી સામાજિક સંસ્થાઓમાં કાર્યકર્તાઓની ખોટ ના રહે.

પ્રમુખશ્રી નિમિષ કડકીઆએ આશ્વાસન આપ્યું હતું અને આભાર માની સભા બરખાસ્ત જાહેર કરી હતી.

મંત્રી : શ્રી રાજેન્દ્ર દેસાઈ (લાટવાળા), શ્રી પરેશ પરીખ (દુધવાલા)

શ્રી બાલાસિનોર પ્રગતિ સમાજ

પ્રોગ્રામ એન્ડ ઈવેન્ટ મેનેજમેન્ટ મેડીકલ સેમીનારનો અહેવાલ

ઉપરોક્ત સંસ્થાનો સેમિનાર તા. ૬-૯-૨૦૧૩ના રોજ સાંજે ૬.૩૦ કલાકે સેનેટ હોલ, સ્ટેટસ રેસ્ટોરેન્ટ, નરીમાન પોઈન્ટ ખાતે યોજાયો હતો. આપણી જ્ઞાતિના તથા આમંત્રિત મહાનુભાવો સાથે લગભગ ૧૬૫ વ્યક્તિઓએ આ પ્રોગ્રામનો લાભ લીધો હતો.

NM Medical ના ચેરમેન ડૉ. નિલેષભાઈ મોહનલાલ શાહે પોતાની આગવી છટાથી લગભગ ૮૦ થી ૮૫ મિનિટ સુધી લોકોને જકડી રાખેલાં વિસ્તૃત હરણફાળ અને જીવનમાં આવેલી પોતાની અંગત મુશ્કેલીઓમાંથી ઉપર આવી એક આદર્શ વ્યક્તિત્વ ધરાવતાં ડૉ. નિલેષભાઈએ આપણી જ્ઞાતિના ભાઈઓ તથા બહેનો માટે એક અગત્યની જાહેરાત કરી હતી. તા. ૩૦-૧૧-૨૦૧૩ સુધી લાભલેનાર દરેક વ્યક્તિ પોતાની ધર્મપત્ની સાથે એમણે દર્શાવેલી હેલ્થકેર પેકેજ લેશે તો આવી વ્યક્તિને પૂરા પેકેજના ખર્ચ સાથે ધર્મપત્નીને તે પેકેજ મફત કરી આપવામાં આવશે. ટૂંકમાં કહીએ તો Buy One Get One Free આમ પોતાની ઉદારતા બતાવવા બદલ સંસ્થા ડૉ. નિલેષ શાહનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

નિમિષ કડકીયા - પ્રમુખ, પંકજભાઈ ધારીઆ - કન્વીનર

શ્રી કે.એમ.જી. જનરલ હોસ્પિટલ, બાલાસિનોર

કચેરીઆ મોજીલાલ ગોરધનદાસ જનરલ હોસ્પિટલ ટ્રસ્ટની ૧૭મી તથા બાલાસિનોર સેવા સમાજની ૪૯મી વાર્ષિક સામાન્ય સભામાં સૌનું અભિવાદન કરતા પ્રમુખશ્રી નવીનચંદ્ર ચીમનલાલ શાહએ વાર્ષિક સામાન્ય સભાનું પ્રમુખસ્થાન સંભાળ્યું હતું.

હોસ્પિટલની તા. ૧-૬-૨૦૧૩ થી તા. ૧૦-૯-૨૦૧૩ દરમિયાનની વિભાગવાર આંકડાકીય માહિતી તથા હોસ્પિટલની કામગીરીનો અહેવાલ સ્થાનિક મંત્રીશ્રી રજનીકાંત ઓચ્છવલાલ શાહે સભા સમક્ષ આપ્યો હતો.

કચેરીઆ મોજીલાલ ગોરધનદાસ જનરલ હોસ્પિટલ ટ્રસ્ટની તા. ૧૩-૯-૨૦૧૩ના રોજ મળેલી ૧૭મી વાર્ષિક સામાન્ય સભામાં એજન્ડા મુજબ ગત વાર્ષિક સામાન્ય સભાની કાર્યનોંધનું વાંચન કારોબારી મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ દેસાઈએ કર્યું હતું. તેમજ વર્ષ ૨૦૧૨-૨૦૧૩ના વાર્ષિક અહેવાલને બહાલી આપવા માટેનો ઠરાવ તેમજ હોસ્પિટલ તથા ટ્રસ્ટના અન્વેષિત હિસાબી નિવેદનો મંજૂર કરવા બાબતનો ઠરાવ તેમજ વર્ષ ૨૦૧૩-૨૦૧૪ માટે માનદ્ અન્વેષકની નિમણૂક

અંગેના ઠરાવો સર્વાનુમતે પસાર કર્યા હતા.

તેમજ બાલાસિનોર સેવા સમાજ ટ્રસ્ટની ૪૯મી વાર્ષિક સામાન્ય સભામાં એજન્ડા મુજબ કારોબારી મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ દેસાઈએ વાંચન કર્યું હતું અને જરૂરી ઠરાવો પસાર કર્યા હતા.

વાર્ષિક સામાન્ય સભાના બીજા દિવસે તા. ૧૪-૯-૨૦૧૩ના રોજ ટ્રસ્ટની કાર્યવાહક સમિતિની એક મિટિંગ લોનાવાલા ખાતે પ્રમુખશ્રીના નિવાસ્થાને યોજવામાં આવેલ. જેમાં ગત મિટિંગની મિનિટસ કારોબારી મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ દેસાઈએ વાંચી સંભળાવી એજન્ડા મુજબની કામગીરી કરવામાં આવેલ.

સર્વ સભ્યશ્રીઓનો આભાર માની સભાનું સમાપન કરવામાં આવેલ.

શ્રી રાજેન્દ્ર દેસાઈ, શ્રી નિતિન પરીખ
માનદ્ મંત્રીઓ

જ્યોતિપુંજ અંગે અગત્યની જાહેરાત

આ વર્ષે દિવાળી તા. ૩-૧૧-૨૦૧૩ના રોજ હોવાથી આપણી સર્વ સંસ્થાઓને તથા તમામ બાલાસિનોરવાસીઓને નમ્ર વિનંતી કે જ્યોતિપુંજમાં પ્રગટ કરવા માટેની આપની તમામ બાબતો તા. ૩૦-૧૦-૧૩ પહેલા સંસ્થાની ઓફિસમાં પહોંચતા કરશો.

- મંત્રી : શ્રી ભાવેશ મોદી

**SHREE BALASINOR NAVYUVAK SANGH PRESENTS
SHREE NATVERLAL CHUNILAL MODY
JANSATHI CRICKET TROPHY 2013-14**

Cricketing season is about to commence and the first of the tournaments is JANASATHI TROPHY 2013-14. This year, we will be having four teams with 72 players. This year there has been a splurge in new youngsters making an entry to play this tournament, which is a good sign for our future.

The Committee invited FOUR SPONSORS to represent each TEAM. The Team will be identified by the name of the Sponsor and all the Six Teams will fight for the Coveted JANSATHI CRICKET TROPHY.

All the players will be presented with a T-SHIRT as well as a CAP for their respective Team/Sponsor.

The Players will have to compulsory wear the Sponsors attire during the matches.

Deatils of the four team sponsors will be printed in the next edition of jyoti punj.

This year also we have received sponsorship for various awards such as Man of the Match, Best Batsman (of the Tournament), Best Bowler (of the Tournament) and Man of the Tournament with Special Prizes. There will also be a prize money for the winning team as awarded last year.

These prizes are sponsored by Shri Samir Rameshchandra Desai (Menpurawala) for which the Committee would like to thanks him.

FOUR TEAMS FOR THE JANSATHI CRICKET TOURNAMENT 2013-14 ARE AS FOLLOWS :

APURV DHARIA (CAP)	ROHAN DHARIA (CAP)	RIPAL PARIKH (CAP)	VISHAL JARIWALA (CAP)
KINJAL PARIKH (WK)	CHIRAG PARIKH (WK)	TEJAS SHAH (WK)	CHIRAG DESAI (WK)
CHIRAG DESAI	RIKIT MODY	SHITEN KADAKIA	NIRAV DESAI
JIMISH DESAI	ROHAN DESAI	DIPEN MODY	MITEN PARIKH
SAHIL DESAI	DHARAV PARIKH	SAMIR R DESAI	DAXIT GANDHI
PANKAJ KADAKIA	JIGAR PARIKH	SANIL DESAI	PARESH PARIKH
NIHAR KADAKIA	ANKUR PAREKH	VIVEK GUPTA	UTSAV MODY
SUKETU PARIKH	PRITESH THAKKAR	ANISH PARIKH	RUCHIT DOSHI
SATISH LAKADAWALA	SANJAY MODY	MITESH DHARIA	SANJIV DHARIA
RITESH KADAKIA	SAMIR MODY	DIVYA KADAKIA	DEVANG PARIKH
RIPAL DESAI	RONAK DHARIA	KUNAL PARIKH	DHAVAL SHAH
DHAVAL MEHTA	RUPESH D MODY	MITUL PARIKH	CHETAN KADAKIA
RIKKIN DESAI	MITHUL DOSHI	DARSHIT MODI	HARSHIT GANDHI
CHINTAK PARIKH	MIHIR KADAKIA	ROHAN D DESAI	SACHIT PARIKH
CHIRAG MODI	DHAVAL MODI	JAY DOSHI	SOHAIL DESAI
MANIT PARIKH	RUSHIL DESAI	ARPIT DHARIA	NILPESH MODI
BHAVIK DHARIA	SAGAR BAXZ	ARPIT GANDHI	SUMMET ENGG
ANKIT SHAH	YATIN DESAI	MONIL MODY	KRUNAL DESAI

PLAYING FORMAT OF JANSATHI TROPHY 2013-14

- (1) Each team will play against each other once.
- (2) Each team will play three matches in the league..
- (3) Net Run Rate will come into effect if points are equal.
- (4) Two points will be awarded to the team winning the match.
- (5) One point extra for beating the opposition by a margin of 20%.
- (6) Top two teams will play the finals.
- (7) Winner will lift the Coveted JANSATHI CRICKET TROPHY.

Thanking You,

Bhavesh Modi
(Secretary)

Chirag Parikh
(Convenor)

BALASINOR PREMIER LEAGUE T20 TOURNAMENT

Balasinor Premier League(bpl T20) Will Be Played With Four Teams This Year.

Shri Alpesh Yogesh Dharia Will Be The Trophy Donor For The Bpl T20 Tournament For The Next Two Years.

Four Team Owners Have Been Finalised As

- (1) Shri Nitin Kacharia (Thassrawala)
- (2) Shri Bhavin Rajkumar Mehta (Padalwala)
- (3) D.C.C.
- (4) Anonymous Sponsor

Tentative Dates Of The Tournament Will Be On Saturday's & Sunday's Of February & March 2014.

For Any Information Regarding The Tournament Kindly Contact Chirag Parikh (9821574856).

Bhavesh Modi
(Secretary)

Chirag Parikh
(Convenor)

હે શ્રીજી

માનવ કેરો, અવતાર દીધો,
આભાર તુજનો, માનવો રહ્યો,
રૂણ તારૂં, ચૂકવવું રહ્યું
અંતમાં મુખ, નામ તારૂં !

નયનો સમક્ષ, તારી છાયા,
હરેક ઘડકને, તારી માયા,
રાત'દિ જપુ, તુજની માળા,
તુજ નામ થકી, ગુંજે કાયા !

શ્રીજી સંગ તું, પ્રિત બાંધીલે,
હાથ ખાલી, ખાલી રહેશે !
કર્મ મુજથી એવા થાય
જનમ મારો સફળ થાય !
પ્રકાશ જળકે અગનમાં,
વિસરજન દેહનું રાખમા !

- ચાંદશા

- ચંદ્રકાંત શાહ (ચટઈ)

પ્રકીર્ણ વિભાગ

મૃત્યુ નોંધ

જયેન્દ્ર ચંદ્રકાન્ત ભટ્ટ	ઉંમર ૫૬
પ્રેમીલા ચંદ્રકાન્ત શાહ (હાથીખાનાવાળા)	૭૩
બીપીનચંદ્ર ભીખાલાલ કડકીયા (ફાડીયા)	૭૯
સુજાતા સુનીલ પરીખ (લેહંટા)	૫૪
તારાબેન ચીમનલાલ પરીખ (જાડા)	૯૩

પ્રભુ સદ્ગતના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.



કોકીલાબેન બિપિનચંદ્ર ઝવેરી
(અમદાવાદ)

ઉંમર વર્ષ - ૭૪

શ્રીજીચરણ : તા. ૨૧-૦૮-૧૩

ચક્ષુદાન કરેલ છે.

નેત્રદાન (ચક્ષુદાન) માટે સંપર્ક કરો - ૧૯૧૬

શુભ લગ્ન

સૌરભ પરેશ પરીખ (બખલી)

પાયલ દિપક કડકીયા

તેજસ્વી તારલાં

- ✳ શાહ પ્રકૃતિ નિલેશ ઠાસરાવાળા B. E. Electro & Tele Comuation) માં S. P. IT. Engineering College માંથી થુ આઉટ ડીસ્ટીંગ્શન સાથે ઉત્તીર્ણ થયા છે.
- ✳ સલોની સચીવ પરીખ C.A. પાસ કરી Masters in International Managment માટે લંડન રવાના થયા છે.
- ✳ પુજા ઉર્મિલ રશ્મીકાંત ધારીઆ (લાલખાં) B.Tech- Computer Science & Engineering માં ૮૩.૮% પાસ થયેલ છે.

સંસ્થાવતી સૌને અભિનંદન.

શ્રી બાલાસિનોર નવયુવક સંઘ ઉપનગર વિભાગ

આ સાથે શ્રીમતી મણીબેન મણીલાલ શાહ, પુરસ્કૃત પારિતોષિકનું વિતરણ ધો. ૧ થી ૯ ગુજરાતી તેમજ ઈંગ્લીશ મીડીયમનું રાખવામાં આવ્યું છે. દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમની માર્કશીટની ઝેરોક્ષ કોપી પાછળ એડ્રેસ અને ફોન નં. લખી કોઈપણ ઉપનગર વિભાગના કાર્યકર્તાઓને પહોંચાડી દેવી સાથે ઓરીજનલ માર્કશીટ બતાવવી. તા. ૨૦-૧૧-૨૦૧૩ પહેલાં પહોંચાડવી.

માર્કશીટ આપવાનું સ્થળ :

- ✳ શ્રી હેમેન્દ્રભાઈ રમણલાલ શાહ : સી/૩૦૨, સુમેર નગર, એસ.વી.રોડ, બોરિવલી (વેસ્ટ), મુંબઈ.
- ✳ શ્રી નિમિષ બાબુલાલ ગાંધી : બી/૩૧, રાજેશ એપાર્ટમેન્ટ, શંકરલેન કાંદિવલી (વેસ્ટ), મુંબઈ
- ✳ શ્રી અજય પ્રવિણચંદ્ર દોશી : બી/૧૨, નવશીલ્પવાની, લલ્લુભાઈ પાર્ક, અંધેરી (વેસ્ટ), મુંબઈ
- ✳ શ્રી બાલાસિનોર નવયુવક સંઘની ઓફિસ : ૧૧૮/૧૨૦, આદરેશર દાદીસ્ટ્રીટ, મુંબઈ.

કન્વિનર : સુનીલ મોદી - ૯૮૨૦૧૨૦૬૪૯

મંત્રી : શ્રી ભાવેશ મોદી - ૯૮૭૯૪૨૨૩૦૪